



(५) संवरतुं स्वरूप

[अवनता शुभाशुभ भावो केम अटकाववा ते यतावनारु' स्वरूप]

#5: Nature of beginning of purity within
And how to prevent auspicious and inauspicious
inclinations to come within



उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो ।
कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ॥१८१॥

उपयोगमां उपयोग के। उपयोग नहि क्रोधादिमां,
छे क्रोध क्रोध महीं न, निश्चय क्रोध नहि उपयोगमां १७१

अर्थः—उपयोग उपयोगमां छे, क्रोधादिकमां कोर्ध उपयोग
नथी; वणा क्रोध क्रोधमां न छे, उपयोगमां निश्चयथी क्रोध नथी.



The mode of the attentive consciousness belongs to the all knower soul substance. The toxic emotions of anger etc do not belong to all knower soul substance.

Toxic emotions of anger etc. arise from anger material karma fruition.

From absolute perspectives the toxic emotions and attentive consciousness are entirely different. 181



जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि ।
तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं ॥ १८४ ॥

ज्यम अग्नितप्त सुवर्णं पणु निज स्वर्णभावाव नहीं तणे,
त्यम कर्मउदये तप्त पणु ज्ञानी न ज्ञानीपणुं तणे. १८४.

अर्थः—जेम सुवर्णं अग्निथी तप्त थयुं थकुं पणु तेना
सुवर्णपणुाने छोडतुं नथी तेम ज्ञानी कर्मना उदयथी तप्त थये।
थके पणु ज्ञानीपणुाने छोडतो नथी.



- Just as even while being hot and melting, the gold does not lose its attributes and characteristics of being gold.
- Similarly, the enlightened soul even while facing the intense heat of material karma fruition, does not give up its attributes of being a knower only. 184



सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो ।
जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ॥ १८६ ॥

જે શુદ્ધ જાણે આત્મને, તે શુદ્ધ આત્મ જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્મને, અણશુદ્ધ આત્મ જ તે લાહે. ૧૮૬.

અર્થ:—શુદ્ધ આત્માને જાણતો—અનુભવતો જીવ શુદ્ધ
આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો—અનુભવતો
જીવ અશુદ્ધ આત્માને જ પામે છે.



- While knowing and experiencing the pure state of self, soul attains that pure state. Whereas the soul knowing and experiencing impure state ends up residing in this impure state. 186



अप्पाणमप्पणा रुंधिऊण दोपुण्णपावजोगेसु ।
दंसणणाणम्मिह ठिदो इच्छाविरदो य अण्णम्मिह ॥ १८७ ॥
जो सब्वसंगमुक्को ज्ञायदि अप्पाणमप्पणो अप्पा ।
ण वि कम्मं णोकम्मं चेदा चित्तेदि एयत्तं ॥ १८८ ॥
अप्पाणं ज्ञायंतो दंसणणाणमओ अण्णमओ ।
लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ॥ १८९ ॥



પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી,
દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઘ્ન ધ્યા પરિહરી, ૧૮૭.

જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે,-
-નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮.
તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે,
બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯.

અર્થ:—આત્માને આત્મા વડે જે પુણ્ય-પાપરૂપ શુભાશુભ-
યોગોથી રોકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય(વસ્તુ)ની
ઘ્નથી વિરમ્યો થકો, જે આત્મા, (ઘ્નરહિત થવાથી) સર્વ
સંગથી રહિત થયો થકો, (પોતાના) આત્માને આત્મા વડે ધ્યાવે
છે—કર્મ અને નોકર્મને ધ્યાતો નથી, (પોતે) *ચેતયિતા (હોવાથી)
એકત્વને જ ચિંતવે છે—ચેતે છે—અનુભવે છે, તે (આત્મા),
આત્માને ધ્યાતો, દર્શનજ્ઞાનમય અને Xઅનન્યમય થયો થકો અલ્પ
કાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.



Living being stops his auspicious and inauspicious inclinations and now gets engrossed in his attributes of knowledge and perception. He now has no desires for any alien objects and has detached himself from all associative relationship. He gets engrossed in his true eternal state and does not experience fruition of material karma or quasi karma. Since in reality soul is only consciousness- supreme nature of knowing and perceiving only, such soul singularly focuses on this attribute and therefore experiences the same. He experiences conscious nature of the self. He gets engrossed in his knowledge and faith and in short time will become karma free and will obtain nirvana. 187,188,189.